

B.A. Semester - 6 (CBCS) Examination
March/April -2020

ECONOMICS : P22 BANKING AND FINANCIAL MARKET - 2(CORE - 22)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

-
- પ્રશ્ન.૧ ભારતમાં બેંકિંગ પદ્ધતિનું માળખું ટૂંકમાં સમજાવો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૧ ભારતમાં વ્યાપારી બેંકોના રાષ્ટ્રીયકરણ માટેના કારણોની ચર્ચા કરો.
- પ્રશ્ન.૨ નરસિંહ કમિટીની બેંકિંગ ક્ષેત્રે સુધારા અંગેની મુખ્ય ભલામણોની ચર્ચા કરો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૨ રાષ્ટ્રીયકૃત વ્યાપારી બેંકોની સમસ્યાઓ વર્ણવો.
- પ્રશ્ન.૩ શાખ નિયંત્રણના ગુણાત્મક સાધનોની વિગતે ચર્ચા કરો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૩ ભારતમાં બિન-બેંકિંગ નાણાકીય સંસ્થાઓના લક્ષણો ચર્ચો.
- પ્રશ્ન.૪ વિકાસ બેંકોનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ ચર્ચો. (૧૪)
 અથવા
- પ્રશ્ન.૪ મધ્યસ્થબેંકનો અર્થ આપી તેના કાર્યો ચર્ચો.
- પ્રશ્ન.૫ ટુંકનોંધ લખો: (કોઈપણ બે) (૧૪)
- (1) પ્રાથમિક બજારમાં સેબી (SEBI) ની ભૂમિકા
 - (2) રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD)
 - (3) પ્રાદેશિક ગ્રામીણ બેંક
 - (4) આયાત - નિકાસ બેંક

ENGLISH VERSION

- Q.1 Explain in brief the structure of banking system in India. (14)
 OR
- Q.1 Discuss the causes of nationalization of commercial banks in India.
- Q.2 Discuss the main recommendations of Narsiham committee for reforms in banking sector. (14)
 OR
- Q.2 Examine the problems of nationalized commercial banks.
- Q.3 Discuss in detail the qualitative measures of credit control. (14)
 OR
- Q.3 Discuss the characteristics of non – banking financial institution in India.
- Q.4 Give the meaning of development banks and discuss it's characteristics. (14)
 OR
- Q.4 Explain the meaning of central bank and it's functions.
- Q.5 Write Short note: (Any Two) (14)
- (1) The Role of SEBI in the primary market.
 - (2) NABARD.
 - (3) Regional rural bank.
 - (4) EXIM BANK
